

[18/A-6]
E.T.R

Mat No.

No. of Printed Pages: 4

Sc

SARDAR PATEL UNIVERSITY
T.Y. B.Sc. EXAMINATION, SEM - V
COMPUTER SCIENCE

US05CCSC06: Computer Graphics

Date: 03/11/2018, Saturday Time: 10:00am To 01:00pm Max. Marks: 70 [10]

Q - 1 Multiple Choice Question:

- i) Persistence phosphor is used in animation.
 - a) Low
 - b) Medium
 - c) High
 - d) None of the Above
- ii) Electron gun is used to maintain picture in DVST.
 - a) Primary
 - b) Secondary
 - c) Ternary
 - d) None
- iii) _____ is a primary input device for entering string.
 - a) Mouse
 - b) Joystick
 - c) Trackball
 - d) Keyboard
- iv) _____ is a single character that can be displayed in different colors and in different sizes.
 - a) Marker Symbol
 - b) Character
 - c) Font
 - d) Layout
- v) Lines generated with pen shapes can be displayed in various widths by changing _____.
 - a) Pen style
 - b) Size of the mask
 - c) Brush style
 - d) Size of the brush/pen
- vi) _____ type has small lines or accents at the end of the main character.
 - a) Symbols
 - b) Sans serif
 - c) Verdana
 - d) Serif
- vii) Rotation point is also known as _____.
 - a) Rotation angle
 - b) Rotation axis
 - c) Pivot point
 - d) Translation vector
- viii) _____ transformation that distorts the shape of an object.
 - a) Rotation
 - b) Shear
 - c) Scaling
 - d) Translation
- ix) The process of converting analog signals to digital signals by way of taking discrete samples is called _____.
 - a) digitizing
 - b) non-digitizing
 - c) both (a) & (b)
 - d) None of above
- x) The analog means _____.
 - a) continuous varying
 - b) stepwise varying
 - c) non varying
 - d) none

Q - 2 Answer the following questions in short: (Any 10) [20]

- i) State disadvantage of Beam Penetration method.
- ii) State disadvantages of DVST.
- iii) Differentiate between impact and non-impact printers.
- iv) List the joins used when two line intersect. Explain any one.
- v) List caps used at the end of line. Explain any one.
- vi) Differentiate: Bitmap font and Outline font
- vii) What is scaling? And list out its types.
- viii) Explain point clipping. State condition for clipping a point.
- ix) Define: 1) Window 2) Viewport
- x) List the categories of multimedia.
- xi) List the benefits of Digital Audio.
- xii) List the Audio jacks.

(1)

(P.T.O)

- Q - 3** A) Explain working of CRT in detail. [05]
B) Differentiate between Raster scan displays and Random scan displays. [05]

OR

- Q - 3** C) List all types of input devices and explain any two in detail. [05]
D) Write short note on Shadow mask method. [05]

- Q - 4** What is inside-outside test? Explain various methods to perform the same. [10]

OR

- Q - 4** A) Write steps for DDA line drawing algorithm. [05]
B) Explain boundary fill algorithm (8-connected) with diagram. [05]

- Q - 5** A) Write a short note on Viewing Pipeline. [05]
B) What is text clipping? List out all types and explain it with example. [05]

OR

- Q - 5** C) Explain in brief Cohen Sutherland Line Clipping Algorithm. [05]
D) What is geometric transformation? List all 2-D geometric transformation and explain any one in detail. [05]

- Q - 6** A) What is multimedia? Also explain various facets of multimedia. [05]
B) Write brief note on Digital Medium. [05]

OR

- Q - 6** Write brief note on '2D & 3D Animation Techniques'. [10]

(2)

(Q.P.Q)

18/A-6
E+G

No. of Printed Pages : 4

સરદાર પટેલ યુનિવર્સિટી

દાયક વિભાગ : શાસ્ત્ર અને તાંત્રિક શિક્ષણ

ક્રમાંક : ૫૧૦

ક્રમાંક : ૫૧૦

ક્રમાંક : ૫૧૦

તારીખ: 03/11/2018, સમય: 10: 00 એ.એમ. થી 01:00 પી.એમ. મહત્વમાં ગુણ: 70

પ્રશ્ન - 1 મલ્ટીપલ ચોઇસ પ્રશ્ન [10]

- એનિમેશનમાં _____ પરિસ્તિષ્ઠાન ફોસ્ફરનો ઉપયોગ થાય છે.
 એ) નિરન બી) મધ્યમ સી) ઉચ્ચ ડી) ઉપરોક્તમાંથી કોઈ નહીં
- DVST માં ચિત્રને જાળવવા માટે _____ ઇલેક્ટ્રોન બંદ્દુકનો ઉપયોગ કરવામાં આવે છે.
 એ) પ્રાથમિક બી) માધ્યમિક સી) ટર્નરી ડી) કોઈ નહીં
- _____ શબ્દમાળા દાખલ કરવા માટે પ્રાથમિક ઇનપુટ ઉપકરણ છે.
 એ) માઉસ બી) જોયસ્ટિક સી) ટ્રેકબોલ ડી) કીબોડ
- _____ એ એક જ અક્ષર છે જે જુદા જુદા રંગો અને વિવિધ કદમાં પ્રદર્શિત થઈ શકે છે.
 એ) માર્કર સિલ્ફોલ બી) કેરેક્ટર સી) ફોન્ટ ડી) લેખાઉટ
- વેન આકારથી પેદા થયેલ લાઇન્સ _____ ને બદલીને વિવિધ પહોળાઈમાં પ્રદર્શિત કરી શકાય છે.
 એ) વેન સ્ટાઇલ બી) માર્કનું કદ સી) બ્રશ સ્ટાઇલ ડી) બ્રશ / વેનનું માપ
- વિન્યાસમાં મુખ્ય પાત્રના અંતમાં નાની રેખાઓ અથવા ઉચ્ચારો છે.
 એ) સિલ્ફોલ્સ બી) સાન્સ સેરીઝ સી) વર્ણના ડી) સેરીઝ
- પરિભ્રમણ બિંદુ _____ તરીકે પણ ઓળખાય છે.
 એ) પરિભ્રમણ કોણ બી) પરિભ્રમણ અક્ષ સી) પીવોટ બિંદુ ડી) અનુવાદ વેક્ટર
- વિન્યાસમાં પરિવર્તન જે ઓફ્જેક્ટના આકારને વિકૃત કરે છે.
 એ) પરિભ્રમણ બી) શીયર સી) સ્કેલિંગ ડી) અનુવાદ
- અસમર્થ નમૂનાઓ લેવા દ્વારા એનાલોગ સંકેતોને ડિજિટલ સંકેતમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને _____ કહેવામાં આવે છે.
 એ) ડિજિટાઇઝિંગ બી) બિન-ડિજિટાઇઝિંગ
 સી) બંને (એ) અને (બી) ડી) ઉપરોક્તમાંથી કોઈ નહીં
- એનાલોગ એટલે _____
 એ) સતત બદલાતી બી) ધીમે ધીમે બદલાતી રહે છે સી) અલગ અલગ ડી) કોઈ નહીં

પ્રશ્ન.2 નીચેના પ્રશ્નોના જવાબ દ્રોગમાં આપો: (કોઈપણ 10)

[20]

- બીમ પેનિટ્રેશન પદ્ધતિનો ગેરલાલ આપો.
- ડિવીએસ્ટીના ગેરફાયદા આપો.

(P.T.O.)

- iii) impact and non-impact પ્રિન્ટરો વચ્ચે તફાવત કરો.
- iv) જ્યારે બે લીટી છૂટે છે ત્યારે ઉપયોગમાં લેવાયેલ જોડાણોની સૂચિ લખો. કોઈ એકને સમજાવો.
- v) રેમાના અંતમાં વપરાયેલી કેપ્સની સૂચિ લખો. કોઈ એકને સમજાવો.
- vi) લિન્કટાઃ બીટમેપ ફોન્ટ અને રૂપરેખા ફોન્ટ
- vii) સ્કેલિંગ શું છે? અને તેના પ્રકારોની યાદી આપો.
- viii) બિંદુ ક્લિપિંગ સમજાવો. બિંદુને ક્લિપ કરવા માટેની સ્થિતિ લખો.
- ix) વ્યાખ્યાયિત કરો: 1) વિંડો 2) વ્યૂપોર્ટ
- x) મલ્ટીમીડિયાના વર્ગોની સૂચિ લખો.
- xi) ડિજિટલ ઓડિઓના ફાયદાઓની સૂચિ લખો.
- xii) ઓડિયો જેકની સૂચિ લખો.

પ્રશ્ન - 3 એ) સીઆરટીનું કામ વિગતવાર સમજાવો. [05]

બી) રાસ્તર સ્કેન ડિસ્પ્લે અને રેન્ડમ સ્કેન ડિસ્પ્લે વચ્ચે તફાવત લખો. [05]

અથવા

પ્રશ્ન - 3 સી) તમામ પ્રકારની ઇનપુટ ડિવાઇસીસની સૂચિ બનાવો અને કોઈપણ બેને

વિગતવાર સમજાવો. [05]

ડી) શેડો માસ્ક પદ્ધતિ પર ઢ્રેકા નોંધ લખો. [05]

પ્રશ્ન - 4 અંદરની - બાહ્ય પરીક્ષા શું છે? તે કરવા માટે વિવિધ પદ્ધતિઓ સમજાવો. [10]

અથવા

પ્રશ્ન - 4 એ) ડીડીએ લાઇન રેખાંકન એળ્વોરિધમ માટે પગલાં લખો. [05]

બી) આકૃતિ સાથે boundary fill એળ્વોરિધમ (8-જોડાયેલ) સમજાવો. [05]

પ્રશ્ન - 5 એ) Viewing પાઇપલાઇન પર ઢ્રેકા નોંધ લખો. [05]

બી) ટેક્સ્ટ ક્લિપિંગ શું છે? બધા પ્રકારોની સૂચિ બનાવો અને ઉદાહરણ સાથે સમજાવો. [05]

અથવા

પ્રશ્ન - 5 સી) સંક્ષિપ્તમાં કોહેન સધરલેન્ડ લાઇન ક્લિપિંગ એળ્વોરિધમ સમજાવો. [05]

ડી) ભૌમિતિક પરિવર્તન શું છે? બધા 2-ડી ભૌમિતિક પરિવર્તનની સૂચિ બનાવો અને કોઈપણ વિગતવાર સમજાવો. [05]

પ્રશ્ન - 6 એ) મલ્ટીમીડિયા શું છે? મલ્ટીમીડિયાના વિવિધ પાસાઓને પણ સમજાવો. [05]

બી) ડિજિટલ મીડિયમ પર સંક્ષિપ્ત નોંધ લખો. [05]

અથવા

પ્રશ્ન - 6 '2 ડી અને 3 ડી એનિમેશન ટેકનીક્સ' પર ઢ્રેકી નોંધ લખો. [10]

